



SHOWROOMS & OFFICES

VISION FOR A BETTER OUTLOOK

35
OFFICES

16
SHOWROOMS


કોઈપણ બિઝનેસ કે સ્ટાર્ટઅપમાં શરૂઆતથી જ સફળતા નથી મળવા લાગતી પણ હા, એ સફળતાની નજર સામે આવવાની શરૂઆત જરૂર થાય છે અને આવો અનુભવ આપને “આસોપાલવ પ્રાઈમ”માં જરૂર થશે.



“KNOCK
KNOCK”

THE CORPORATE
DYNAMITE







"KNOCK
KNOCK"

ELEVATE YOUR
SCALE







તમે કોઈપણ સારા વ્યવસાય સાથે ભલે સંકળાયેલા હોવ, પણ લોકો તમને
ઓળખતા થાય છે તમારી ઓફિસથી અને એ પણ જો “આસોપાલવ પ્રાઈમ”
જેવા પ્રાઈમ કોમર્શિયલમાં હોય, તો તમે કોઈ પણ ઓળખાણનાં મોહતાજ નથી!

“KNOCK
KNOCK”

WIDE FRONT OFFERS
COMFORT




GROUND FLOOR PLAN



1ST TO 6TH
TYPICAL FLOOR PLAN



BASEMENT PLAN



TERRACE PLAN



FEATURES

ELEVATION

- Contemporary building elevation.
- Maintenance free design.
- Dynamic lighting design.

PARKING

- Well organised basement parking.
- Dedicated parking for two wheelers on Terrace.
- Sufficient parking space for visitors.

COMMON AREA AND PASSAGES

- Decorative lighting in common passages.
- High grade railings for entire staircase and passage areas.
- Auto door lift for passengers and terrace parking.

STRUCTURE

- RCC frame structure with earthquake resistant design.

FLOORING

- Standard vitrified tiles.
- Natural stone in staircase.

ELECTRIFICATION

- Standard quality cable wiring and modular switches with ISI standard fixtures.
- AC and Internet connection points in each unit.
- Provision of sufficient AC points with dedicated space for AC outdoor units.
- Provision of total power back up of DG sets for elevators, water pumps and lighting in common areas.

Project By:



Architecture
Rachana Planning
98256 14576

Structural Consultant
Krapa Structural Consultant
94277 22416

Rera No : PR/GJ/RAJKOT/RAJKOT/Others/CAA08001/030221

Website : www.gujrera.gujarat.gov.in

Disclaimer
• Legal expenses, Stamp duty, G.E.B. charges, RMC charges for drainage & water connection, GST, etc. shall be borne by the members. • Any additional Charges or duties levied by the Government/Local authorities during or after the completion of the scheme will be borne by the purchaser. • In the interest of continual developments in design & quality of construction, the developer reserve all rights to make any changes in the scheme including technical specification, designs, planning layout & all the allotments / purchaser shall abide by such changes. • Changes / alteration of any including the elevations, exterior colour scheme of the building or any other change affecting the overall design concept and outlook of the scheme are strictly NOT PERMITTED during or after the completion of the scheme. • The brochure is intended only to convey the essential design & technical features of the scheme and does not form any part of legal document.

KEY PLAN



Scan For Location



Site Address

80 Ft. Main Road, Near Matuki Restaurant, Mavdi, Rajkot.

Contact

+91 91043 43091